



Australian Government

COVID-19
VACCINATION

એસ્ટ્રાઝેનેકા વિશેની માહિતી

એસ્ટ્રાઝેનેકા રસી

એસ્ટ્રાઝેનેકા રસી અને ભાગ્યે થતી એક (શારીરિક) તકલીફ વચ્ચે એક સંબંધ (લિંક) છે, જેમાં લોહીના ગંઠાઇ જવા અને લોહીના ટ્રાક કણ (પ્લેટલેટ)ના નીચા સ્તરનો સમાવેશ થાય છે. આ તકલીફને થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (ટીટીએસ) સાથે થ્રોમ્બોસિસ કહેવામાં આવે છે.

બધા જ પુખ્ત વયના લોકો માટે COVID-19 રસીકરણની ભલામણ કરવામાં આવે છે. ૬૦ વર્ષથી ઓછી ઉંમરના પુખ્ત વયનાઓ માટે ફાઇઝર રસી COVID-19 સામેની પસંદગીની રસી છે. જો કે, ૬૦ વર્ષથી ઓછી ઉંમરના પુખ્ત વયના લોકો હજુ પણ એસ્ટ્રાઝેનેકા રસી લેવાનું પસંદ કરી શકે છે. તમારો નિર્ણય લેવામાં મદદ કરવા માટે તમારા ડાક્ટર સાથે વાત કરો.

૬૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને એસ્ટ્રાઝેનેકા રસી આપવામાં આવશે.

થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (જે ટીટીએસ તરીકે ઓળખાય છે) સાથે થ્રોમ્બોસિસ શું છે?

થ્રોમ્બોસિસનો અર્થ લોહીની ગાંઠ થાય છે.

થ્રોમ્બોસાયટોપેનિયા એટલે લોહીના પ્લેટલેટનું નીચું સ્તર.

ટીટીએસ એસ્ટ્રાઝેનેકા રસીની, ભાગ્યે થાય તેવી સંભવિત આડઅસર છે. જો તે થાય, તો તે ગંભીર હોય શકે છે અને અપંગતા અથવા મૃત્યુનું કારણ બની શકે છે. ટીટીએસ લોહીની ગાંઠો બનાવે છે, જે શરીરના જુદા જુદા અંગોમાં હોય શકે છે. તેનાથી લોહીના પ્લેટલેટનું સ્તર પણ નીચું જઈ શકે છે, જેને કારણે રક્તસ્રાવ થઈ શકે છે. ફાઇઝર રસી અને ટીટીએસ વચ્ચે કોઈ લિંક નથી.

ટીટીએસ ક્યારે થાય છે?

ટીટીએસના નોંધાયેલા કિસ્સાઓ સામાન્ય રીતે એસ્ટ્રાઝેનેકા રસીના પ્રથમ ડોઝ પછી, રસીકરણના ૪થા થી ૪૨મા દિવસની વચ્ચે થયા છે.

ટીટીએસ કેટલું સામાન્ય છે?

ટીટીએસ ભાગ્યે થાય છે. જેમણે એસ્ટ્રાઝેનેકા COVID-19 રસી લીધી હોય તેવા ૧૦૦,૦૦૦ લોકોમાંથી લગભગ ૧-૨ લોકોને તે અસર કરવાનો હાલમાં અંદાજ છે. ૬૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે, આ દર હાલમાં ઊંચો એટલે કે, ૧૦૦,૦૦૦ લોકોમાંથી ૨-૩ લોકો હોવાનો અંદાજ છે. જેમ જેમ વધુ માહિતી ઉપલબ્ધ થશે તેમ તેમ આ અંદાજમાં સુધારા-વધારા કરવામાં આવશે.

શું ટીટીએસનું જોખમ કોઈ જૂથને વધુ છે?

ટીટીએસ નાની ઉંમરના પુખ્ત વયના લોકોમાં વધુ સામાન્ય હોવાનું જણાય છે, જો કે કેટલાક મોટી ઉંમરના પુખ્ત લોકોમાં પણ તે નોંધવામાં આવ્યું છે. જો પહેલેથી હોય તેવી કોઈ તબીબી તકલીફ લોહીની ગાંઠો બનાવવામાં ફાળો આપતી હોય તો, અમને ખબર નથી. સંશોધકો આની તપાસ કરી રહ્યા છે.

ટીટીએસના લક્ષણો શું છે?

ટીટીએસ નીચે મુજબના કેટલાક લક્ષણો પેદા કરી શકે છે:

- સતત રહેતો માથાનો ગંભીર દુખાવો કે જે:
 - રસીકરણના ઓછામાં ઓછા ૨ દિવસ પછી શરૂ થાય છે
 - સાદી પીડાનાશક દવાથી ઓછો થતો નથી
 - સૂઈ જવાથી કદાચ વધે
- ઊલ્ટી અને ઉબકા
- ઝાંખું દેખાવું
- બોલવામાં મુશ્કેલી
- સુસ્તી લાગવી
- ખેંચ આવવી
- શ્વાસ લેવામાં મુશ્કેલી
- છાતીમાં દુખાવો
- તમારા પગમાં સોજો
- પેટમાં સતત દુખાવો
- ઇન્જેક્શન માર્યું હોય ત્યાંથી દૂર, ત્વચા હેઠળ નાની લોહીની ફોલ્લીઓ.

જો તમને અથવા અન્ય વ્યક્તિને COVID-19 રસીકરણ પછી આમાંની કોઈપણ ગંભીર આડઅસર થાય તો, તમારે તરત જ ૦૦૦ પર ફોન કરવો જોઈએ.

શું એસ્ટ્રાઝેનેકા રસીના ફાયદા જોખમો કરતાં વધારે છે?

હા. રસીકરણના ફાયદા તેના જોખમો કરતાં વધારે છે, ખાસ કરીને વૃદ્ધ લોકો માટે, જેમને COVID-19થી અત્યંત બીમાર થવાનું જોખમ વધુ છે.

જો તમે ૬૦ વર્ષથી ઓછી ઉંમરના છો અને એસ્ટ્રાઝેનેકાના તમારા પ્રથમ ડોઝ લેવા માટે નોંધાવ્યું હોય તો શું?

જો તમે એસ્ટ્રાઝેનેકા રસીનો તમારો પ્રથમ ડોઝ લેવા માટે નોંધાવ્યું હોય અને તમારી ઉંમર ૬૦ વર્ષથી ઓછી છે, તો તમારા ડાક્ટર જોડે વાત કરો. તેઓ તમારે રસી લેવી કે નહિ તે નક્કી કરવામાં તમને મદદ કરશે.

જો તમે એસ્ટ્રાઝેનેકા રસીનો તમારો પ્રથમ ડોઝ લઈ લીધો હોય અને હવે બીજો ડોઝ લેવાનો સમય થયો હોય તો શું?

ટીટીએસના લગભગ તમામ નોંધાયેલ કિસ્સા એસ્ટ્રાઝેનેકા COVID-19 રસીના પ્રથમ ડોઝ પછી થયા છે. જો તમને એસ્ટ્રાઝેનેકા રસીના પ્રથમ ડોઝ પછી કોઈ ગંભીર આડઅસરો ન થઈ હોય તો, તમે તમારો બીજો ડોઝ લેવામાં વિશ્વાસ રાખી શકો છો, પછી ભલે તમે ૬૦ વર્ષથી નાના હોવ.

જેમને પહેલાં લોહીની ગાંઠો થઈ હોય તેવા લોકો માટે શું એસ્ટ્રાઝેનેકા રસી સુરક્ષિત છે?

જો તમને પહેલાં અન્ય પ્રકારની લોહીની ગાંઠો થઈ હોય, અથવા લોહી ગંઠાવાનું જોખમ હોય તો પણ, તમે એસ્ટ્રાઝેનેકા રસી લઈ શકો છો. એવા કોઈ પૂરાવા નથી કે પહેલાં લોહીની ગાંઠો થઈ હોય તો, એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી ટીટીએસનું જોખમ વધે છે.

વધુ માહિતી માટે

જો તમને એસ્ટ્રાઝેનેકા રસી બાબતમાં પ્રશ્નો હોય તો, તમારા ડાક્ટર જોડે વાત કરો, www.health.gov.au/covid19-vaccines-languages પર જાવ અથવા રાષ્ટ્રીય કોરોનાવાયરસ સહાય રેખાને ૧૮૦૦ ૦૨૦ ૦૮૦ પર ફોન કરો. અનુવાદ અને દુભાષિયા સેવા માટે ૧૩૧ ૪૫૦ પર ફોન કરો.